

B.A. Semester - 5 (Remedial) (CBCS) Examination
March/April-2025 (NEW COURSE)
ECO P16 Entrepreneurship -1(Core -16)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ ઉદ્યોગ સાહસિકનો અર્થ સમજાવી તેના લક્ષણોની ચર્ચા કરો. (૧૪)
 અથવા
 પ્રશ્ન-૧ ભારતમાં ઉદ્યોગ સાહસિક વર્ગના વિકાસ માટે લેવામાં આવેલા પ્રોત્સાહક પગલાઓ વર્ણવો.
 પ્રશ્ન-૨ ડેવિડ મેકલલેન્ડનો સિદ્ધિ પ્રેરણાના સિદ્ધાંતની સમજૂતી આપો. (૧૪)
 અથવા
 પ્રશ્ન-૨ કમ્પ્યુટર દ્વારા રજૂ કરવામાં આવેલ નવ પ્રવર્તનના સિદ્ધાંતની ચર્ચા કરો.
 પ્રશ્ન-૩ ઔદ્યોગિક સાહસની સ્થળ પસંદગીને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. (૧૪)
 અથવા
 પ્રશ્ન-૩ બાહ્ય પર્યાવરણના પરિવર્તનમાંથી નિરૂપણ થતી ઔદ્યોગિક તકોનું વિશ્લેષણ કરો.
 પ્રશ્ન-૪ ઉદ્યોગ સાહસિકની સામાજિક જવાબદારીનો અર્થ સમજાવી, રાષ્ટ્ર તરફની સામાજિક જવાબદારી સમજાવો. (૧૪)
 અથવા
 પ્રશ્ન-૪ ઉદ્યોગ સાહસિકની કર્મચારીઓ અને રોકાણકારો તરફથી સામાજિક જવાબદારી સમજાવો.
 પ્રશ્ન-૫ ટૂંકનોંધ લખો: (કોઈપણ બે) (૧૪)
 1) સાહસ મૂડીનું સ્વરૂપ.
 2) સાહસની સ્થળ પસંદગીનું મહત્વ.
 3) ઉદ્યોગ સાહસિક વર્ગમાં વિકાસ માટેના સૂચનો
 4) ભારતમાં સાહસ મૂડી ફંડોની કામગીરી.

ENGLISH VERSION

- Que-1 Explain the Meaning of Entrepreneur, Discuss its characteristics. (14)
 OR
 Que-1 Describe the Motivation steps taken in India for the development of entrepreneur class.
 Que-2 Explain the theory of Achievements Motivation of David Melland. (14)
 OR
 Que-2 Discuss the principle of Innovation Presented by Schumpeter.
 Que-3 Discuss the effective Factors of Localization establishment of Industrial Unit. (14)
 OR
 Que-3 Analyze Industrial Opportunities Resulting From the change in External Environment.
 Que-4 Explain the Meaning of social Responsibility of Business Entrepreneur and Explain their social Responsibilities toward the Nation. (14)
 OR
 Que-4 Explain Entrepreneur social Responsibilities towards Employers and Investors.
 Que-5 Write Short Note: (Any Two) (14)
 1) Nature of Venture capital.
 2) The Importance of Location choice of enterprise.
 3) The Suggestions for development of Entrepreneur class.
 4) The Activity of Venture capital Funds in India.
